

SAL/SE/2022-23/P32

September 16, 2022

To,
The Manager, Listing
Metropolitan Stock Exchange of India Limited
Vibgyor Towers, 4th Floor, Plot No. C 62, G-Block,
Opp. Trident Hotel, Bandra Kurla Complex,
Bandra (E), Mumbai-400098

Dear Sir,

Sub: Publication of Advertisement for the Annual General Meeting Notice, Book Closure and E-voting

With regard to above and in compliance with the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of Financial Express (English) and Jai Hind (Gujarati) edition dated 4th September, 2022 wherein Notice for the 40th Annual General Meeting and the Notice pursuant to provisions of Section 91 and Section 108 of the Companies Act, 2013 for Book Closure and E-voting for the purpose of Annual General Meeting of the Company to be held on 26th September, 2022 was published.

You are requested to kindly find the above in order and arrange for updation of records accordingly.

Thanking You,

Faithfully Yours,

For SAANVI ADVISORS LIMITED

ROOPESH VED DIRECTOR (DIN: 01504998)

Encl: As Stated

Regd. Office: 304, Shoppers Plaza V, The Govt. Servants Co Op Housing Society Limited, Opp. Municipal Market, C. G. Road, Navrangpura, Ahmedabad 380 009.

CIN: L74140GJ1981PLC084205 • Email: saptharishifin@gmail.com • Ph. No.: 079 48904153

FE SUNDAY



BHAVNAGAR MAIN BRANCH: Bunder Road. Bhavnagar - 364001

[See Rule 8 (1)] Possession Notice (For Immovable Property)

Whereas, The undersigned being the Authorised Officer of Bank of Baroda, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 23.05.2022 calling upon the Borrower / Guarantor / Mortgagor Mrs. Shardaben Vijaybhai Makwana (Borrower) & Mr. Vijaybhai Bachubhai Makwana (Co Borrower) to repay the amount mentioned in the notice being Rs. 22,25,971.92 (Rs. Twenty Two Lakhs Twenty Five Thousand Nine Hundred Seventy One & Paisa Ninety Two Only) plus uncharged interest & other charges from 24.05.2022, within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Guarantor / Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantor / Mortgagor and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below n exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on this 29th day of August the year 2022.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower/Guarantor/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda, for an amount of being Rs. 22,25,971.92 (Rs. Twenty Two Lakhs Twenty Five Thousand Nine Hundred Seventy One & Paisa Ninety Two Only) plus uncharged interest & other charges till date of payment.

Security agreement with brief description of securities

All That Piece & Parcel of Immovable Property Bearing S. No 72, Plot no 105 Sidhivinayak Township, Ring Road, Bharatnagar, Guru Ashish residency, Build up area 93.36 Sq. Mtrs., Carpet area 93.36 Sq. Mtrs., Bhavnagar - 364 001 in the name of Mrs. Shardaben Vijaybhai Makwana.

The said property is bounded as under:

East: Adi Plot No. 106 North: Adj Plot No. 105 & Unit A West: Plot No. 104 South: Entrance & 9.00 Mt Wide Road

Date: 29.08.2022 Place : Bhavnagar Chief Manager & Authorised Officer, Bank Of Baroda

(Abhay Asthana)

) बैंक ऑफ़ बड़ीदा Bank of Baroda

BHAVNAGAR MAIN BRANCH: Bunder Road, Bhavnagar - 364001

[See Rule 8 (1)] Possession Notice (For Immovable Property)

Whereas, The undersigned being the Authorised Officer of Bank of Baroda, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 28.02.2022 calling upon the Borrower / Guarantor / Mortgagor Mrs. Thakker Vibhaben Pareshbhai (Borrower) & Mrs. Kavitaben Nareshbhai Anvani (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 13,33,220.43 (Rs. Thirteen Lakhs Thirty Three Thousand Two Hundred Twenty & Paisa Forty Three Only) plus uncharged interest & other charges from 01.03.2022, within 60 days from the date of receipt of the said notice.

The Borrower / Guarantor / Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantor / Mortgagor and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on this 29th day of August of the year 2022.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower/Guarantor/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda, for an amount of being Rs. 13,33,220.43 (Rs. Thirteen Lakhs Thirty Three Thousand Two Hundred Twenty & Paisa Forty Three Only) plus uncharged interest & other charges till date of payment.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

1. All that Piece and Parcel of Immovable Property being Commercial Property bearing Stall No. B/14, Basement, Radheshyam Complex, Plot No. 3, Admeasuring 53.58 Sq Ft., Nr. Radha Mandir, Wagha wadi Road, Bhavnagar - 364002 as per M.O.E. dated 13.11.2020 in the name of Mrs. VibhabenPareshbhai Thakkar. Bounded as

North: Shop No. 25. East: Internal Passage, West: Shop No. 13 South: Internal Passage

2. All that Piece and Parcel of Immovable Property being Residential Property bearing Flat No. 6659, Block No. 31, Shiv Ranjani Society, 19 MIG, Near Gayatrinagar, Admeasuring 51 Sq. Mtrs. as per sale deed and as on site 47 Sq. Mtrs., Bhavnagar as, per M.O.E. dated 13.11.2020 in the name of Mrs. Kavitaben Nareshbhai Anvani Bounded as under:

North: Flat No. 6658, East: Open Space, West: Stair Case & Then Flat No. 6660 South: Open Space

Date: 29.08.2022 (Abhay Asthana) Place: Bhavnagar Chief Manager & Authorised Officer, Bank Of Baroda



Babra Branch: Nr. Kariyana Chowk, Rajkot - Bhavnagar Highway, Babra, Tal.: Babra, Dist.: Amreli - 365 421

[See Rule 8(1)] POSSESSION NOTICE (For Immovable & Movable Property)

Whereas, The undersigned being the Authorised Officer of Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon him under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 13.05.2022 calling upon the Borrower/Guarantor/Mortgagor M/s Ganesh Food Industries (Partnership firm), Mr. Kapilbhai Chhaganlal Khanpara (Partner & Guarantor), Mrs. Bipin Jayantibhai Atara (Partner & Guarantor), Mr. Chhaganbhai Ravjibhai Khanpara (Guarantor) to repay the amount mentioned in the notice being Rs.64,21,866.25 (Rs. Sixty Four Lakhs Twenty One Thousand Eight Hundred Sixty Six & Paisa Twenty Five Only) plus uncharged interest & other charges from 14.05.2022 with in 60 days from the date of receipt of the said notice.

The Borrower/Guarantor/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules as per details mentioned herein below.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act. in respect of time available, to redeem the secured assets.

The Borrower/Guarantor/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda, for an amount of being Rs. 64,21,866.25 (Rs. Sixty Four Lakhs Twenty One Thousand Eight Hundred Sixty Six & Paisa Twenty Five Only) plus uncharged interest & other chargestill date of payment.

Description of the Movable/Immovable Property

1. Hypothecation of Plant & Machineries situated at Plot No. D-9, 10, 11, 12 and 13 admeasuring 1250-00 Sq. Mtrs. of Revenue Survey No. 717/P of Babra-II Industrial Estate within village limits of Babra, Tal: Babra, Dist. Amreli in the name of M/s. Ganesh Food Industries (Partnership firm), Mr. Kapilbhai Chhaganabhai Khanpara (Partner) & Mr. Bipinbhai Jayntibhai Atara (Partner). Machinery Name: 1. Santi figure, 2. Blower 7.5 HP, 3. Alivator 20 feet*7, 4. Ghanti

24"*2, 5. Grinding Machine, 6. Gravity, 7. Distoner, 8. Round Chino 8*3, 9. Xpra Channel 2 Nos (With Blower), 10. Krusher, 11. Flakers, 12. Corn Grinder, 13. Cooker, 14. Tank 4*4*7 feet *2, 15. Tank 3*4*5 feet *2, 16. Scrooconver 20 feet, 17. Blower 2 HP, 18, Water pump, 19, Boiler

Date of Possession: 30.08.2022, Place: Babra

2. All that Piece & Parcel of Immovable Property of Plot No. D-9, 10, 11, 12 and 13 for industrial purpose total admeasuring 1250-00 Sq. Mtrs. of Revenue Survey No. 717/P of Babra-II Industrial Estate within village limits of Babra, Tal: Babra, Dist. Amreli in the name of M/s. Ganesh Food Industries (Partnership firm), Mr. Kapilbhai Chhaganabhai khanpara (Partner) & Mr. Bipinbhai Jayntibhai Atara (Partner). together with all buildings and structures standing thereon or to be erected here after and attached to the earth or permanently fastened to anything attached to earth, both present and future. The said property is bounded as under: North - Estate Boundary, South - 14.00 Mtrs. wide Estate Road, East - Plot No. D-14, West - Plot No. D-8

Date of Possession: 30.08.2022, Place: Babra

3. All that Piece & Parcel of Immovable Property of Residential House consist of two Rooms, Kitchen, Varandah, etc. total admeasuring 91.86 Sq. Mtrs. on the land of City Survey Sheet No. 7, Survey No. 495 in Ramji Mandir Street at Village DerdiKumbhaji, Tal.: Gondal, Dist.: Rajkot in the name Chhaganlal Ravjibhai Khanpara (Guarantor). The said property is bounded as under: North - Property Of Mr. Hirachand Jechand, South - Common wall with the property of Mr. Navinchandra Mohanlal Davda, East - Common Wall with the property of Mr. Kantilal Karsanjibhai, West - Public Road.

Date of Possession: 01.09.2022, Place: DerdiKumbhaji

4. All that Piece & Parcel of Immovable Property of Ground floor, Godown No. 17 total admeasuring 16.72 Sq. Mtrs. (Up to Slab Level) for Commercial purpose on the land Revenue Survey No. 154/1, 154/2 Paiki on Varasada Road, outside Municipal limit, Amreli in the name Bipinkumar Jayantilal Atara (Partner & Guarantor). The said property is bounded as under: North - Common Wall with Godown No. 18, South - Common Wall with Godown No. 16, East - Road Leading to Vallabh Chambers, West - Open land of Original owner. Date of Possession: 01.09.2022, Place: Amreli

> (Rajiv RanjanJha) Authorized Officer & Chief Manager Bank of Baroda, Babra Branch



indianexpress.com

I arrive at a conclusion not an assumption.

Inform your opinion with detailed analysis.

The Indian Express. For the Indian Intelligent. ♦ The Indian EXPRESS -JOURNALISM OF COURAGE



Asset Recovery Management Branch: 21 Veena Chambers Mezzanine Floor, Dalal Street, Near Bombay Stock Exchange, Fort, Mumbai-400023. Mobile: 8928211305 Email: arb.msm@unionbankofindia.com

E-AUCTION SALE NOTICE (UNDER SARFAESI ACT)

E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE ASSETS UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH PROVISON TO RULE 8 (6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s), that the below described immovable property mortgaged charged to the Secured Creditor, the physical/symbolic possession of which has been taken by the Authorised Officer of Union Bank of India (Secured Creditor will be sold on "AS IS WHERE IS", "AS IS WHAT IS", "WHATEVER THERE IS" AND "WITHOUT RECOURSE BASIS" on 21.09.2022 in between 10:00 AM to 03:00 PM, for recovery of respective amounts, due to the Union Bank of India (Secured Creditor) from the respective Borrower(s) and Guarantor(s) as mentioned below. The Reserve Price and Earnest Money Deposit will be as mentioned below, For details terms and conditions of the sale, please refer to the link provided in Union Bank of India (Secured Creditor) website i.e. www.unionbankofindia.co.in. Bidder may also visit the website https://www.ibapi.in The under mentioned properties will be sold by Online E- Auction through website: www.mstcecommerce.com on 21.09.2022 for recovery of respective amounts plus interest and other expenses in the respective borrowers accounts.

"Online E- Auction through website : www.ibapi.in Date & Time of Auction: 21st SEPTEMBER 2022 at 10.00 A.M. to 03.00 P.M.

Lot. No.	a) Name Of TheBorrower/ b) Name Of The Branch c) Description Of Property d) Name Of The Owner/S	a) Reserve Price In Rupees b) Earnest Money Deposit (Emd) (In Rupees)	Debt Due Contact Person and Mobile No. Inspection Date / Time	Possession Symbolic/ Physical
1	a) M/s Aastha Sarees b) Asset Recovery Management Branch c) Shop No. G/1(West Part of Shop No. 08), Sarthi Residency, Building -B, B/s Federal Bank, Surat, Puna-Kumbhariya Road, Opposite Shayam-Sangini, Kumbhariya Road, Surat-395010 admeasuring 1730.00 Sq Ft Carpet Area d) Mr. Satisbhai Gopalbhai Patel		Rs. 8,30,91,393.00 (Rs.Eight Crore Thirty Lakh Ninety One Thousand Three Hundred Ninety Three Only) as on 30.06.2022 plus further interest thereon w.e.f 01.07.2022 at applicable rate of interest, cost and charges till date. Mr. Gyanendra Kumar Singh - Mobile No. 8874927777 Mr. Shailesh Singh-Mobie No. 8052113909 12.09.2022/11.00 AM to 5.00 PM	Not known to A.O. Physical Possession
2	a) M/s Vaidehi Enterprises b) Asset Recovery Management Branch c)Flat No 815, 8th Floor, Building D, Shiv Residency Althan Road, Village Bhimrad, Surat, Gujarat- 395007 admeasuring 531.00 Sq ft Built up area & 825.00 Sq ft Super built up area d) Mr. Ajay Tarachand Bhootra		Rs.3,90,50,339.16/- (Rs.Three Crore Ninety Lakh Fifty Thousand Three Hundred Thirty Nine and Paise Sixteen Only) as on 30.06.2022 plus further interest thereon w.e.f. 01.07.2022 at applicable rate of interest, cost and charges till date. Mr. Bodhan Biswas - Mobie No. 8928211305 Ms. Naveen - Mobile No. 9592585898 16.09.2022/3.00 PM to 5.00 PM	Not known to A.O. Symbolic Possession
3	a) M/s Vaidehi Enterprises b) Asset Recovery Management Branch c)Shop No 410, 4th Floor, Aastha Corporate Capital, VIP Road area, Village Bharthana Vesu, Surat, Gujarat- 395007 admeasuring 2252.00 Sq ft Carpet area & 4100.00 Sq ft Built up area d) Mr. Suresh Goyal		Rs.3,90,50,339.16/- (Rs.Three Crore Ninety Lakh Fifty Thousand Three Hundred Thirty Nine and Paise Sixteen Only) as on 30.06.2022 plus further interest thereon w.e.f. 01.07.2022 at applicable rate of interest, cost and charges till date. Mr. Bodhan Biswas - Mobie No. 8928211305 Ms. Naveen - Mobile No. 9592585898 16.09.2022/3.00 PM to 5.00 PM	Not known to A.O. Symbolic Possession

Bidders are requested to visit the Bank's website www.unionbankofindia.co.in for detailed terms & conditions of E-Auction and other details before submitting their Bids for taking part in the E-Auction. Bidder may also visit the website www.ibapi.in. of Service Provider Indian Banks Auction Properties Information (IBAPI) Portal. The intending bidders must have valid e-mail id to participate in on-line Auction. The terms and conditions of sale shall be strictly as per the provisions of The Security Interest (Enforcement) Rules, 2002.

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER RULE 8(6) / RULE 9(1) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES 2002 This may also be treated as notice under Rule 8(6) / Rule 9(1) of Security Interest (Enforcement) Rules, 2002 to the borrower/s and guarantor/s of the said loan about

the holding of E-Auction Sale on the above mentioned date. For detailed terms and condition of the sale, please refer to the linkprovided i.e www.unionbankofindia.co.in or https://www.ibapi.in

www.mstcecommerce.com

Place : Mumbai Date: 04.09.2022

Authorized Officer, Union Bank of India

यूनियन बैंक (G) Union Bank



Race Course Circle Branch: Opp. Indoor Stadium, Race Course Circle, Rajkot.

POSSESSION NOTICE (Rule 8(1))

Whereas, The undersigned being the Authorised Officer of Union Bank of India Race Course Circle, Rajkot under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 09.06.2022 calling upon the borrower M/s. Vision Bio Product Pvt. Ltd. to repay the amount mentioned in the notice being Rs. 3,09,35,302.90 (Rupees Three Crore Nine Lakhs Thirty Five Thousand Three Hundred two and Ninety Paisa Only), within 60 days from the date of receipt of the said notice.

The Borrower as well as Guarantors having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken/recieved Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules u/s 14 on this 29th day of August of the year 2022 & 03rd day of September of the year 2022.

The Borrower/Guarantor's attention is invited to provision of Sub-Section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower/Guarantors in Particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the properties will be subject to the charge of Union Bank of India, Race Course Circle Branch, Rajkot for an amounts of Rs. 3,09,35,302.90 (Rupees Three Crore Nine Lakhs Thirty Five Thousand Three Hundred two and Ninety Paisa Only) as on 31.03.2022 and Further interest and expense thereon.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES

 Non-Agricultural (Commercial Purpose) Factory Land & Building thereon, admeasuring 59259 Sq. Ft. (Originally 8296-00 Sq. Mts.) situated at Revenue Survey No. 200 P5 of Village: Surva, Taluka: Talala, Dist.: Gir Somnath. Owned & Occupied by M/s Vision Bio Products India.

2. Residential House No. A-11/2 over the land admeasuring 61.67 Sq. Mtrs. (73.76 Sq. Yards) of Sub Plot No. 13 to 15+ 18 to 20/5 to 20/4 paiki, Northern side land of the area known as "Maruti Park" (Old Yogi Park) of Village: Metoda, R. S. No. 46, 47/1 8 48/2 paiki of Taluka : Lodhika, Dist. : Rajkot owned by Mr. Sureshbhai Shivabhai Sipariya and Mr. Shivabhai Bachubhai Sipariya.

Residential House No. A-1 over the land admeasuring 61.58 Sq. Mtrs. (73.65 Sq. Yards) of Sub Plot No. 9 to 12 and 21 to 24/2+3 palki, Southern side land of the area known as "Maruti Park" (Old Yogi Park) of Village: Metoda, R. S. No. 46, 47/1 & 48/2 paiki of Taluka : Lodhika, Dist. : Rajkot owned by Mr. Jigneshbhai Shivabhai

Sipariya and Mr. Shivabhai Bachubhai Sipariya. 4. Commercial Property, admeasuring 33-26 Sq. Mtrs. addressed as Office No. 232 (16.63 Sq. Mtrs.) and Office No. 233 (16.63 Sq. Mtrs.) located on 2nd Floor of the building known as "Municipal Shopping Centre", Backbone Shopping Centre, Nr. Mayani Chowk, Chandresh Nagar Main Road, constructed over the land admeasuring 4043.00 Sq. Yards of F.P. No. 74 of T.P. Scheme No. 3, City Survey No. 2851 paiki of Ward No. 6 of Rajkot, Owned & Occupied by Mr. Jigneshbhai Shivabhai Sipariya.

Residential House (under construction) over the land admeasuring about 68.975 Sq. Mtrs. (82.50 Sq. Yards) of Plot No. 29P of NA land of R. S. No. 469/2 & 470P, City Survey Ward No. 16, C. S. No. 943 addressed as Plot No. 29P, Opp. Aradhana Society, After Airport Railway Crossing, Airport Road, Rajkot. Owned by Mr. Ghanshyambhai Shivshankarbhai Mehta.

Date: 03.09.2022, Place: Rajkot Authorised Officer, Union Bank Of India

Saanvi

Regd Office: 304, Shopper's Plaza - V, Government Servants Co-Op. Housing Society Limited, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad - 380009. CIN: L74140GJ1981PLC084205 Ph. No.: 079-48904153

Website: www.saanviadvisors.in Email: saptharishifin@gmail.com NOTICE OF 40TH ANNUAL GENERAL MEETING, E-VOTING & BOOK CLOSURE INFORMATION

Notice is hereby given that The 40th Annual General Meeting (AGM) of the Company will be held on Monday, 26th September, 2022 at 12:30 P.M. at the Registered Office of the Company situated at 304, Shopper's Plaza - V, Government Servants Co-op. Housing Society Limited, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad -380009 to transact the businesses as set out in the Notice of the Meeting dated August 13, 2022.

Electronic copies of the Notice of the AGM and Annual Report for the Financia year 2021-22 have been sent to all the Members holding shares as on August. 26, 2022, whose email IDs are registered with the Company / Depository Participant(s). These documents are also available on the website of the Company, at www.saanviadvisors.in and also on the Link Intime India Private Limited (LIIPL) website instavote linkintime co.in and website of Metropolitan Stock Exchange of India Limited, at www.msei.in. The Company has completed the dispatch of notice of 40th AGM along with the Annual Report 2021-22 on 03rd September, 2022.

Members holding shares either in physical form or dematerialized form, as on the cut-off date (16th September, 2022), may cast their vote electronically on the business as set forth in the Notice of the AGM through electronic voting system of the M/s, Link Intime India Private Limited (LIIPL) from a place other than venue of the AGM ('remote a-voting'). All the members are informed that: I. The business as set forth in the Notice of the AGM may be transacted through voting by electronic means,

II. The remote e-voting shall commence on: Friday, 23rd September, 2022 (9:00 a.m); III. The remote e-voting shall end on: Sunday, 25th September, 2022 (5:00 p.m.). IV. The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is (16th September, 2022);

V. E-voting by electronic mode shall not be allowed beyond 5:00 p.m. IST on September 25, 2022;

VI. Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date i.e. (16th September, 2022), may obtain the login ID and password by sending a request at enotices@linkintime.co.in or can call at 022 - 49186000. VII. Members may note that:

a. The remote e-voting module shall be disabledby M/s. Link Intime India Private

Limited (LIIPL) beyond 5:00 p.m. IST on September 25, 2022 and once the vote on a resolution is castly the Member the Member shall not be allowed to change b. The facility forvoting through ballot/poll ('insta poll') shall be made available

at the AGM: c. The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and

d. Only persons whose name is recorded in the Register of Members or in the

Register of beneficial owners maintained by the depositories as on the cut-off

date only shall be entitled to avail facility of remote e-voting or voting at the

AGM through ballot/ poll; VIII. In case of queries /grievances relating to e-voting, members may refer to the frequently asked questions (FAQs) and Instavote e-voting user manual available at https://instavote.linkintime.co.in, under Help section or write an email to enotices@linkintime.co.in or Call us: 022 - 49186000 or Contact Company Secretary at the Registered Office.

) The Notice is further given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014, the Register of Members of the Company will remain close from 19th September, 2022 to 26th September, 2022 (both days inclusive) for the purpose of as certaining the eligible shareholders for participating in AGM.

Place: Ahmedabad Date: 03/09/2022

For, Saanvi Advisors Limited Ms. Prity Bokaria Company Secretary & Compliance Officer (ICSI Membership No.: A43805)

DEBTS RECOVERY TRIBUNAL-II

Ministry of Finance, Department of Financial Service, Government of India 3rd Floor, Bhikhubhai Chambers, Nr. Kochrab Ashram, Ellisbridge, Paldi, Ahmedabad-380 006

FORM NO.22 (Earlier 62) [Regulation 36 & 37 of DRT Regulations, 2015] [See Rule 52 (1)(2) of the Second Schedule to the Income-tax Act, 1961] READ WITH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993 E-AUCTION / SALE NOTICE

THROUGH REGD.AD / DASTI/AFFIXATION / BEAT OF DRUM / PUBLICATION RP/RC No. 38/2021 O.A. No. 1138/2018

Certificate Holder Bank: State Bank of India

Certificate Debtors : M/s. Mukesh Selection & Ors.

C.D. No. 1: M/s. Mukesh Selection, A Proprietorship Firm, 27/B, Plot No. A, 9 to 11, Shop No. 6-7, Udhna Shopping Center, Station Road, Udhna, Surat - 394210.

C.D. No. 2: Mr. Roshnalal Dharmihand Jain, Proprietor of Firm, 27/B, Plot No. A, 9 to 11, Shop No. 6-7, Udhna Shopping Center, Station Road, Udhna, Surat - 394210. C.D. No. 3: Mr. Mukesh Roshanial Jain, 27/B, Plot No. A, 9 to 11, Shop No. 6-7, Udhna Shopping Center, Station Road,

Udhna, Surat - 394210. The aforesaid CDs No. 1-2 have failed to pay the outstanding dues of Rs. 17,63,258.76 (Seventeen Lakhs Sixty Three

Thousand Two Hundred Fifty Eight and Seventy Six Paisa only) as on 21.08.2018 including interest in terms of judgment and decree dated 01.02.2021 passed in O.A. No. 1138/2018 as per my order dated 24.08.2022 the under mentioned property (s) will be sold by public e-auction in the aforementioned matter. The auction sale will be held through "online e-auction"

https://drt.auctiontiger.net

Lot	Description of the Property	Reserve Price	EMD 10% or
No.		Rounded off	Rounded off
1.	All that piece and parcel of immovable property being Flat No. 301, 3rd Floor, Navkar Apartment, B/h. Udupi Restaurant, Surat - Navsari Road, Mouje Udhna, Sub District - Surat, District - Surat (Gujarat)	Rs. 22.00 Lakh	Rs. 2.20 Lakh

Note* In respect of any claims to be received, if any, priority of payment will be decided in terms of Section 31-B of the RDB Act, 1993(as amended in the year 2016). EMD shall be deposited by through RTGS/NEFT in the account as per details as under:

> Beneficiary Bank Name State Bank of India Beneficiary Bank Address SBI, SARB Vadodara Beneficiary Account No. 40253211845

IFSC Code SBIN0001141

The bid increase amount will be Rs. 10,000/- for Single lot,


2) Prospective bidders may avail online training from service provider M/s E-Procurement Technologies Ltd. (Tel Helpline No. 9265562821 - 079 61200594 / 598 / 568 / 587 / 538 and Mr. Chintan Bhatt (Mobile No. 09978591888), Helpline E-mail ID: support@auctiontiger.net and for any property related queries may contact Shri Pravin Kumar Jha, (Mob. No. 9909045323).

3) Prospective bidders are advised to visit website https://www.drt.auctiontiger.net for detailed terms & conditions and procedure of sale before submitting their bids.

 The prospective bidders are advised to adhere payment schedule of 25% (minus EMD) immediately after fall of hammer/close of auction and 75% within 15 days from the date of auction and if 15th day is Sunday or other Holiday, then on immediate next first bank working day. No request for extension will be entertained.

5) The properties are being put to sale on "as is where is", "as is what is" and "as is whatever" basis and prospective buyers are advised to carry out due diligence properly. 6) Schedule of auction is as under:

SCHEDULE OF AUCTION 16.09.2022 Between 11:00 am to 2:00 pm 1 Inspection of property 2 Last date for receiving bids alongwith earnest 10.10.2022 Up to 05:00 pm money and uploading documents including proof of payment made 3 e-Auction 11.10.2022 Between 12:00 pm to 01:30 pm (with auto extension clause of 03 minutes, till E-Auction ends)



Ahmedabad



કોંગ્રેસમાં નવા અધ્યક્ષને લઈને હંગામો યથાવત

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મતદાર યાદી સાર્વજનિક કરવા માગણી નવી દિલ્હી , તા . ૩ તેવું લાગી રહ્યું છે . મહારાષ્ટ્રના પૂર્વ યાદી સાર્વજનિક કરવાની માંગ કરી

ચુંટણીને લઈને પાર્ટીમાં ચાલી રહેલો કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મતદાર નેતાઓના જુથ જી-૨ ઉના સભ્ય હેંગામો હવે જલ્દી શાંત થવાનો નથી

કોં ગ્રેસમાં નવા અધ્યક્ષની મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચલ્હાશે પણ છે. કોં ગ્રેસના અસંતુષ્ટ વરિષ્ઠ



આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૩ સપ્ટે.આજે લિટલ મિલેનીયમ, ગોતા, અમદાવાદ ખાતે હ્યુમન મોટી સંખ્યામાં બહેનોએ વેલનેસ ક્લિનીક પ્રોગ્રામ કાર્યક્રમમાં ભાગ લીધો હેઠળ

ફાઉન્ડેશનના સંસ્થાપક આર.એસ.પટેલ બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ ફાઉન્ડેશનના ટ્રસ્ટી હિનાબેન જરીવાલા તથા અરિકાબેન પટેલના સહયોગથી લાભાર્થીઓ માટે કિશ્વરી ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્તનના સ્વ. પરીક્ષણ દ્વારા પ મહત્વના પગલાં દ્વારા કોઇ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નીપલમાં થી પ્રવાહી જતું હોય તો આ ચિન્હો દેખાય તો ડોકટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા પહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઇ શકે છે. કેન્સરની આ બિમારી કોઇપણ જાતના દર્દ વિના થતી હોવાથી દર વર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઇલાજ થઇ શકે છે.ચોથા તબક્કે પહોંચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે. આ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી.



પ્રમુખ ઓમકાર રિવન્તાનું આજે લોન્ચિંગ

ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરમાં ૧૦૦ ટકા 'ગ્રીન હોમ્સ' પ્રોજેક્ટ પ્રમુખ ઓમકાર રિવન્તા આકાર લઇ રહ્યો છે. રાંદેસણમાં ધોળેશ્વર મહાદેવ રોડ પર આકાર લઇ રહેલા 'પ્રમુખ

શહેરનો પ્રથમ પ્લેટીનમ રેટેડ ગ્રીન પ્રોજેક્ટ બનશે

ઓમકાર રિવન્તા' નું નિર્માણ ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (આઇજીબીસી)નાં ધોરણોને અનુરૂપ થયું છે.અને તે શહેરનો પ્રથમ પ્લેટીનમ રેટેડ ગ્રીન પ્રોજેક્ટ થશે.આ પ્રોજેક્ટનું આકર્ષક પાસું

એ છે કે તેમાં ૬૫ ટકા પ્લોટ એરિયા ખુલ્લો મળશે. ઉપરાંત આ પ્રોજેક્ટમાં ત્રણ સાઇડ ખુલ્લી હોવાથી હવા ઉજાસ માટે તે આદર્શ સ્થળ બની રહેશે. પ્રમુખ ઓમકાર રિવન્તા કુલ ૨૭૮ યુનિટ્સનો ગ્રીન હોમ્સ પ્રોજેક્ટ છે.

પ્રમુખ ઓમકાર રિવન્તા પ્રોજેક્ટના ડેવલોપર્સ યુવા ઉત્સાહી અને દુરંદેશીતા ધરાવતા પર્યાવરણ પ્રેમીઓ છે.ડાયરેકટર ધવલ બરોલિયાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટના સેમ્પલ હાઉસનું આવતીકાલ તા.૪ સપ્ટે.થી લોન્ચિંગ થઇ રહ્યું છે.મેટ્રો રેલ્વે સ્ટેશનથી આ પ્રોજેક્ટનું અંતર માત્ર પાંચ મિનીટનું છે.સામાન્ય બિલ્ડીંગની સરખામણીમાં ગ્રીન હોમમાં ઉર્જાની ૨૦ ટકાથી ૩૦ ટકા જેટલી બચત અને પાણીમાં ૩૦ ટકાથી ૫૦ ટકા જેટલી બચત થાય છે.



ર**જિ. ઓફિસ** : ૪૦૪ ,૪૦૫ ૪થે માળ , એન્જલ કોમ્પ્લેક્સ , ઇન્કમટેક્ષ, રેલવે કોસિંગ ની નજીક , નવરંગપુરા અમદાવાદ -૩૮૦૦૦૯ • **ફોન**: ૦૭૯ ૨૯૭૦૮૩૮૭ **વેબસાઇટ**: www.rachanainfra.com • **ઇ - મેલ**: rachanainfra404@gmail.com

ર૧મી વાર્ષિક સામાન્ય સભા અને ઈ-મતદાનની નોટિસ

અહીંથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીની એકવિસમી વાર્ષિક સામાન્ય સભા (

એજીએમ) સોમવાર, રદ્દ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ બપોરે ૦૨: ૦૦ વાગ્યે વિડીયો કોન્ફરનિસંગ ("વીસી) / અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ ("ઓએવીએમ") દ્વારા એજીએમ ની નોટિસ માં જણાવેલા ઠરાવ ને મંજૂર કરવા માટે યોજાશે. કંપનીએ એજીએમ ની નોટિસ તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના વાર્ષિક અહેવાલ સાથે, ૦૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ ઇ-મેલ દ્વારા મોકલવામાં આવી છે. જે સભ્યોના ઇ-મેલ આઇડી કંપની/ડિપોઝિટોરી જોડે રજીસ્ટર છે ફક્ત તમનેજ આ ઇવેક્ટ્રોનિક મોડ મોકલવામાં આવશે. આ નોટિસ કોર્પોરેટ એફર્સ મંત્રાલયે (એમસીએ) ના તારીખ પ મે, ૨૦૨૦ના પરિપત્ર સાથે તારીખ ૮ મી એપ્રિલ, ૨૦૨૦, ૧૩ એપ્રિલ, ૨૦૨૦ ૧૩ જાન્યઆરી ૨૦૨૧, ૦૮ ડિસેમ્બર, ૨૦૨૧ અને ૦૫ મે, ૨૦૨૨ના પરિપત્રો ના અનુસંધાને મોકલેલ છે. કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ અને કંપની (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમી, ૨૦૧૪ ના નિયમ ૨૦ ના સુધારા મુજબ અને સેબી (એલોડીઆર) રેગ્યુલેશન ૨૦૧૫ ના રેગ્યુલેશન ૪૪ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ના સામાન્ય સભા ના સેક્રેટ્રિયલ સ્ટાન્ડર્ડ્સ ("એસએસ ૨") ની જોગવાઈ પ્રમાણે સભ્યો ને નોટિસમાં

દશવિલ તમામ ઠરાવો પર તેમના મત આપવા માટે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવેલ ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ (ઇ-મતદાનના) સુવિધા આપવામાં આવી છે. મતના અધિકારો સભ્યો પાસે ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ ની સ્થિતિ મુજબ રહેલા શેર ની સંખ્યા આધારે ગણાશે. કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની જોગવાઈઓ અને તે હેઠળ ધડાયેલા નિયમો મુજબ જરુરી વિગતો નીચે મુજબ છે:

૧. બુક ક્લોશર કરવાનો સમયગાળો ૨૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ થી ૨૬ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ (બંને દિવસો સહિત) સુધી રહેશે:

રિમોટ ઈવોર્ટીંગ શુક્રવાર ૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સવારએ ૦૯:૦૦ વાગે શરુ થાશે અને રવિવાર, રપ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સાંજએ ૦૫:૦૦ વાગે પૂર્ણ થશે;

3. ઈ-મતદાનના હક્કદારો નો હક્ક નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ છે;

જ. ઉપર આપેલ વોટિંગ ના સમયગાળા પછી સભ્યોને રિમોટ ઇ-વોટિંગ દ્વારા મત આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં;

પ. કંપનીએ એજીએમની નોટિસ ઈ-મેલ કર્યા પછી કંપનીના શેર પ્રાપ્ત કરનાર અને કટ-ઓફ તારીખએ જેમના પાસે શેર હશે તે પોતાનો ઈ-મતદાન નો હક્ક મેળવવા

એજીએમ ની નોટિસમાં આપેલી પ્રક્રિયાથી મેળવવી શકે છે; દ ઈ.મતદાન એજીએમ દરમિયાન પણ ઉપલબ્દ રહેશે. જે સભ્યો એજીએમ પેહલા ઈ મતદાન કરી તેમનો મત આપ્યો હોયે તેઓ ("વીસી/ઓએવીએમ") થી એજીએમ

માં હાજર રહી શકશે પણ ફરી થી મત આપી શકશે નઇ;

૭. બોર્ડ એ M/s. મુકેશ એચ. શાહ & કો., કંપની સેક્રેટરીઝ ને ઇ-મતદાનના ના સ્ક્રૂટિનાઇઝર તરીકે નિયુક્ત કરેલ છે. તેઓ ચેરમેન ને ઇ-મતદાનના નો રીજલટ

8. જો શેરધારકોને ઈ-વોર્ટિંગ સંબંધિત કોઈ પ્રશ્નો હોય, તો તેઓ www.evotingindia.com ઉપર હેલ્પ વિભાગમાં ઉપલબ્ધ FAQs રીફર કરે અથવા તો helpdesk@cdslindia.com પર ઇ-મેલ મોકલી શકે છે તથા ૦૨૨-

ર૩૦૫૮૫૪૨/૪૩ ૫૨ સંપર્ક પણ કરી શકો છે. **નિયમિક મંડળના આદેશ દ્વારા** રચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એસ ડી/-ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડીન: ૦૧૬૪૬૭૪૭ સ્થળ: અમદાવાદ તારીખ: સપ્ટેમ્બર ૦૪, ૨૦૨૨



મુંબઇની એક દિવસની મુલાકાતે આવેલા એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશમારીને મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષો ખાતે આવી પહોંચી મુખ્યમંત્રી શિંદેનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કરી રહ્યા છે.

અમેરિકામાં ઘૂસણખોરી કરતા ૧૭ભારતીય નાગરિકો પકડાયા

એજન્ટના ધ્યાનમાં સરહદે થઈ

મેડિકલ તપાસ કરવામાં આવી હતી.

નામ બદલેલ છે

મારૂ જૂનુ નામ રૂચિતા રાજેન્દ્ર

શાહ થી બદલીને નવું નામ

રૂચિતા પિંકલ જોશી કરેલ છે.

સરનામું : ઈ/૭/૯૧, ઓર્ચિડ

હેવન એપ્પલવુડ ટાઉનશીપ,

શેલા, અમદાવાદ

ઓન લાઈન ટેન્ડર

ભરવાની તારીખઃ-

ટેન્ડરની વિગત માટે

તથા ટેન્ડર માટે:-

નવીદિલ્હી,તા.૩ નાગરિકોનો સમાવેશ થતો હતો. ગેરકાયદે તમામ ૧૦૦નું આ ગ્રુપ મોડી રાતે ધૂસણખોરી કરી રહેલા ૧૭ અંધારાનો લાભ લઈને વાડ ભારતીયો સહિત કુલ ૧૦૦ વિદેશી ઓળંગવાની પેરવીમાં હતા. સેન નાગરિકો પકડાયા હોવાનું અમેરિકી ડિઆગો સેક્ટર બોર્ડર પેટ્રોલિંગ સીમા સુરક્ષા એજન્સીએ કહ્યું હતું. પકડાયેલા વિદેશી નાગરિકો રાતે બે રહેલી હિલચાલ આવી હતી એ પછી વાગ્યે કેલિફોર્નિયા સરહદે વાડ આ તમામને પકડી લેવાયા હતા. ઓળંગવાનો પ્રયાસ કરતા હતા એ પકડાયેલા વિદેશી નાગરિકોની

વખતે પેટ્રોલિંગ ટીમના ધ્યાનમાં આવ્યા હતા.અમેરિકન સીમા સુરક્ષા એજન્સીના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે કેલિફોર્નિયાની સરહદે વાડ ઓળંગીને અમેરિકામાં ઘુસવાની ફિરાકમાં રહેલા ૧૦૦ વિદેશી નાગરિકોને પકડી લેવાયા હતા.એમાં ભારતના ૧૭નાગરિકો પણ સામેલ હતા. એ ઉપરાંત સોમાલિયાના ૩૭ નાગરિકો, અફઘાનિસ્તાનના છ નાગરિકો,

નામ બદલેલ છે

પાકિસ્તાનના ચાર, બ્રાઝિલના ત્રણ

મારૂ જૂનુ નામ નરેન ક્રિશનલાલ જુનું નામ હેતલબેન જગદીશકુમાર શારદા થી બદલીને નવું નામ પટેલ હતું તે બદલીને નવું નામ નારાયણ ક્રિશનલાલ શારદા હેતલ જગદીશ પટેલ કરેલ છે. કરેલ છે. સરનામું : ૭, સરનામું : એ/૩૦૨, અભિષેક શિવબાગ કોલોની, ગોપાલ એપાર્ટમેન્ટ, નવા વાડજ, ચોક, મણીનગર, અમદાવાદ અમદાવાદ-૩૮૦૦૧૩

નામ બદલેલ છે

ગણાતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું

કે, કોંગ્રેસ અધ્યક્ષને ચૂંટણી માટે

મતદાર યાદી સાર્વજનિક કરવા માટે

દરેક ચૂંટણીમાં મતદાર યાદી

સાર્વજનિક કરવામાં આવે છે. તેથી

મતદાર યાદી વેબસાઈટ પર મુકવી

જોઈએ અને મતદારોને ઈમેલ દારા

મતદાર યાદી આપવી જોઈએ. જો

વેબસાઈટમાં કોઈ મુકવા અંગે કોઈ

સમસ્યા હોય, તો ઈમેલ કરવો

જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીની

પારદર્શિતા જાળવવા અને કોંગ્રેસમાં

સામાન્ય કાર્યકરનો વિશ્વાસ

પુનઃસ્થાપિત કરવા માટે મતદાર

યાદી સાર્વજનિક કરવા અથવા રસ

ધરાવતા ઉમેદવારને ઈ-મેલ

સાંસદ મનીષ તિવારી, શશિ થરૂર,

કાર્તિ ચિદમ્બરમ પહેલાથી જ

મતદાર યાદીને સાર્વજનિક કરવાની

માંગ કરી ચૂક્યા છે. જ્યારે

કોંગ્રેસમાંથી રાજનામું આપનાર

ગુલામ નબી આઝાદે પણ કોંગ્રેસની

સદસ્યતા અને પ્રમુખની ચૂંટણીની

પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે.

નામ બદલેલ છે

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના

કરવાનો નિર્દેશ આપવો જોઈએ.

પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે,

સુચના આપવી જોઈએ.

મેં મારા સગીર પુત્રનું જુનું નામ પટેલ જેવિન જગદીશકુમાર હતું તે બદલીને નવું નામ પટેલ જેવિન જગદીશ રાખેલ છે. સરનામું : એ/ ૩૦૨, અભિષેક એપાર્ટમેન્ટ, નવા વાડજ, અમદાવાદ-૩૮૦૦૧ ૩

નામ બદલેલ છે

મારૂ જુનું નામ ઠક્કર શર્મીપ્ટાબેન રાજેન્દ્રકુમાર થી બદલીને નવું નામ ઠક્કર શર્મિષ્ઠાબેન રાજેન્દ્રકુમાર કરેલ છે. સરનામું : પ, ઉમીયાદેવી સોસાયટી વિભાગ-૧, મ્યુનિસિપલ માર્કેટ સામે, ખોખરા, અમદાવાદ-૩૮૦૦૦૮

Saanvi

રજીસ્ટર્ડ ઓફિસ : 304, શોપર્સ પ્લાઝા-5, ગર્વમેન્ટ સર્વેન્ટસ કો-ઓપ. હાઉસીંગ સોસાયટી લિમિટેડ, મ્યુનિસિપલ માર્કેટ સામે, સીજી. રોડ, અમદાવાદ - 380009 CIN: L74140GJ1981PLC084205 Phone No.: 079-48904153 Website: www.saanviadvisors.in Email: saptharishifin@gmail.com

૪૦મી વાર્ષિક સામાન્ય સભાની, ઈ-વોટીંગ તથા બુક બંધ થવાની માહિતી અંગે નોટિસ

નોટિસ આપવામાં આવે છે કે

1) કંપનીની ૪૦મી વાર્ષિક સામાન્ય સભા (AGM) સોમવાર, ૨૬મી સપ્ટેમ્બર ર૦૨૨ના રોજ સવારે ૧૨.૩૦ વાર્ગ કંપનીની રજીસ્ટર્ડ એફિસ 304, શોપર્સ પ્લાઝા - 5, ગર્વમેન્ટ સર્વેન્ટસ કો-એપ. હાઉસીંગ સોસાયટી લિમિટેડ, મ્યુનિસપલ માર્કેટ સામે, સી.જી. રોડ, અમદાવાદ - 380009 ખાતે તારીખ ૧૩મી ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ મળેલ મીટિંગની નોટિસમાં જણાવ્યા મુજબના બિઝનેશ માટે મળશે.

૨) નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે AGM અને વાર્ષિક અહેવાલના નોટિસની ઈલેક્ટ્રોનિક નકલો ઓગસ્ટ ૨૬, ૨૦૨૨ના રોજ શેર ધરાવતા તુમામ્ સભ્યોને જેમના ઈમેલ આઈડીઓ કંપની/ડીપોઝટરી પાર્ટીસીપન્ટમાં નોંધાયેલ છે તેઓને મોકલવામાં આવેલું છે. આ દસ્તાવેજો કંપનીની વેબસાઈટ www.saanviadvisors.in અને લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (LIIPL) ની વેબસાઈટ instavote linkintime.co.in અને મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડની વેબસાઈટ www.msei.in. ઉપર પણ ઉપલબ્ધ છે. કંપનીએ ૩જી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ વાર્ષિક રીપોર્ટ ૨૦૨૧-૨૨ ની સાથે ૪૦મી AGM ની નોટિસ મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે.

જે સભ્યો કટ ઓફ ડેટ (૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૨)ના રોજ ફીઝીકલ ફોર્મ અથવા ડિમટીરિલાઈઝ્ડ સ્વરૂપે શેર ધરાવતાં હશે તેઓ ઈલેક્ટ્રોનિક વોટીંગ પ્રણાલી દારા AGM ની નોટિસમાં જણાવેલ કામકાજ મુજબ, AGM (રીમોર્ટ ઈ-વોટિંગ) સિવાયના અન્ય સ્થળેથી મેસર્સ લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (LIIPL) ની સિસ્ટમ્ મુજબ ઈલેકટ્રોનિક વોટિંગ

કરી શકે છે. આ બધા સભ્યોને જણાવાયુ છે કેં : I. AGMની નોટિસમાં જણાવેલ કામકાજ, વોટિંગ ઈલેક્ટ્રોનિક માધ્યમ

II. રીમોટ ઈ-વોટિંગનો પ્રારંભ : શુક્રવાર ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૨, (सवारे ७.०० वागे.)

III. રીમોટ ઈ-વોટિંગ સમાપન : રવિવાર ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૨, (સાંજે ૫.૦૦ વાગે.)

IV. રીમોટ ઈ-વોટિંગ અથવા AGM પર વોટિંગ કરવાની યોગ્યતા નકકી કરવા માટેની કુટ ઓફ તારીખ (૧૬મી સપ્ટેમ્બર, ૨૦૨૨)

V. રીમોટ ઈ-વોટિંગ ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સાંજે ૫.૦૦ વાગ્યા પછી માન્ય રહેશે નહી.

VI. AGMની નોટિસ મોકલાયા બાદ કોઈ પણ વ્યક્તિએ શેર હસ્તગત કર્યા હોય અને કંપનીના સભ્યો બન્યા હોય તેમજ કટ્ ઑફ ડેટ (૧૬મી સપ્ટેમ્બર, ૨૦૨૨) સુધી શેર જાળવી રાખ્યા હોય તો તેઓ પોતાનો login ID અને પાસવર્ડ enotices@linkintime.co.in પર અથવા ફોન નંબર 022 - 49186000 વિનંતી કરી મેળવી શકશે.

VII. સભ્યો નોંધ લે : (a) રીમોટ ઈ-વોટિંગ સીસ્ટમ ૨૫મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સાંજે ૫.૦૦ વાગ્યા પછી મેસર્સ લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (LIIPL) દ્રારા અયોગ્ય કરવામાં આવશે, એક વાર સભ્યએ વોટ્ર આપયા પછી સભ્યને તે પછી થી બદલવાની મંજુરી આપવામાં આવશે નહી.

(b) બેલેટ / મતદાન (ઈન્સ્ટા મતદાન) થી વોટિંગ કરવાની સુવિધા AGM પર ઉપલબ્ધ કરવામાં આવશે.

(c) જે સભ્યોએ AGM પહેલા રીમોટ ઈ-વોટિંગ દ્રારા પોતાનો વોટ આપ્યો છે તે પણ AGM માં હાજર રહી શકશે પરંતુ તેઓ ફરીથી વોટિંગ કરવાને હકકદાર રહેશે નહી અને

(d) જે વ્યક્તિઓના નામ સભ્યોના રજિસ્ટરમાં નોંધાયેલા હોય અથવા કેટ ઓફ ડેટ મુજબ ડિપોઝીટરીઝ દ્વારા જાળવવામાં આવેલા બેનીફીસીયલ ઓનર્સના રજિસ્ટરમાં નોંધાયેલા છે ફક્ત તે જ રીમોટ ઈ-વોટિંગની સુવિધા માટે અથવા AGM પર બેલેટ / મતદાન કરવા હકકદાર રહશે.

VIII. ઈ-વોટિંગ સંબંધિત પ્રશ્નો / ફરિયાદોની બાબતમાં કોઈપણ સભ્ય વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) નો ઉલ્લેખ કરી શકે છે અને ઈન્સ્ટાવોટ ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શન https://instavote.linkintime.co.in પર હેલ્પ સેકશન હેઠળથી મેળવી શકે છે અથવા enotices@linkintime.co.in ઉપર ઈમેલ કરો અથવા ફોન નંબર 022 - 49186000 કર્રો અથવા ૨જીસ્ટર્ડ ઓફિસ ઉપર કંપની સેક્રેટરીનો સંપર્ક કરો.

૪) નોટિસમાં વધુમાં જણાવવાનું કે કંપનીઝ એકટ ૨૦૧૩ની કલમ ૯૧ની જોગવાઈઓને અનુસરીને કંપની (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) ૨૦૧૪ના નિયમ ૧૦ સાથે વાંચતા, AGM માં ભાગ લેવા માટે લાયક શેરેધારકોની ખાતરી કરવા માટે કંપનીના સભ્યોના રજિસ્ટર ૧૯મી સપ્ટેમ્બર, ૨૦૨૨ થી ૨૬મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી (બન્ને દિવસો સહિત) બંધ રહેશે.

સ્થળ : અમદાવાદ

તારીખ : 03-09-2022

સાનવી એડવાઈ ઝર્સ લિમિટેડ વતી Ms. પ્રિતી બોકરીયા કંપની સેક્રેટરી અને પાલન અધિકારી (ICSI મેમ્બરશીપ નં. : A43805)



સામે ફરીવાર નિરાશા મળી ખતરનાક લીકેજ થયું હતું.

આટેમિસ-૧ રેકેટનું ફ્લોરિડાના માટે અત્યાર સુધીના સૌથી ટાળવું પડ્યું હતું.

૩૨૨ ફૂટ લાંબા રેકેટમાં ૧૦ લાખ ગેલન ઇંધણ ભરતા લીકેજ થવા લાગ્યું

કેનેડી સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવાનું હતું તે ટેકનિકલ ખામીના કારણે ટાળવું પડ્યું હતું.

'નાસા' રોકેટ મારફતે ચંદ્રની આસપાસ કુ કેપ્સુલ મોકલવા માંગે છે.અને ત્યારબાદ આગળની ઉડાન દ્વારા અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર પર મોકલવાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં શનિવારે નવા ચંદ્ર રોકેટમાં જયારે તેના પરીક્ષણની અંતિમ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 🎏

તારીખઃ-૨૬-૯-૨૦૨૨ના સાંજના

www.nprocure.com

https://amcnprocure.com.or

ડે.મ્યુનિસિપલ કમિશ્નર, (પૂર્વ ઝોન)

મહાનગર સેવાસદન, પૂર્વઝોન ઈજનેર વિભાગ

ટેન્ડર નોટીસ નં.૧૭

રોડ, પાણી, ડ્રેનેજ બિલ્ડીંગ તથા અન્ય કામોની ટેન્ડર નોટીસ

અચ્યુત હેલ્થકેર લિમિટેડ

રજીસ્ટર્ડ ઓફિસ : 610, કોલોનેડ, ઈસ્કોન મંદિર પાછળ, ઈસ્કોન બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે, ઈસ્કોન - આંબલી રોડ, અમદાવાદ- 380058 ગુજરાત CIN : U67120GJ1996PLC028600 Ph : +91 79 48982691 Email:mahendrazenith@hotmail.com Website:www.achyuthealthcare.com

શેરહોલ્ડરોની રહમી વાર્ષિક સામાન્ય મીટિંગની સભ્યોને નોટિસ

૧૮:૦૦ કલાક સુધી

કેપ કાર્નિવલ તા.૩ તૈયારીઓ માટે તેમાં ઇંધણ શક્તિશાળી ૩૨૨ ફૂટ લાંબા અમેરિકાની સ્પેસ એજન્સી ભરવામાં આવી રહ્યું હતું.ત્યારે રોકેટમાં ૧૦ લાખ ગેલન ઈધણ

મૂન મિશનમાં નાસાને ફરી નિરાશા

'નાસા'ના મુન મિશનના સપ્તાહમાં આ તેના બીજા પ્રયાસ તેના પરીક્ષણને બીજી વખત

ભરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમાં નાસાના વૈજ્ઞાનિકોએ આ લીકેજ શરૂ થવા લાગ્યું ત્યારબાદ



ભાવનગર મહાનગરપાલિકા રોડ વિભાગ ટેન્ડર જાહેરાત

અત્રેના વિભાગ દ્વારા SJMMSVY હેઠળ વિવિધ ગ્રાન્ટ, ખાનગી સોસાયટીની જન ભાગીદારીની ગ્રાન્ટ તથા અન્ય વિવિધ ગ્રાન્ટમાંથી વિવિધ કામો કરાવવા માટે ઓન લાઈન તથા હાર્ડકૉપી દ્વારા પર્સન્ટેજ રેઈટ ટેન્ડર્સ મંગાવવામાં આવે છે.

સંબંધીત શ્રેણીના અને રસ ધરાવતા માન્ય કોન્ટ્રાક્ટરોની જાણ માટે આ કામની વિગતવાર વિજ્ઞાપન અત્રેના વિભાગના નોટીસ બોર્ડ ઉપર મુકેલ છે. ડીટેઈલ ટેન્ડર જાહેરાત તથા ટેન્ડર ડોક્યુમેન્ટ ભા.મ.ન.પા.ની વેબસાઈટ www.bmcgujarat.com ઉપરથી જોઈ શકાશે.

હાર્ડકોપી ટેન્ડર્સ ભા.મ.ન.પા.ની વેબસાઈટ www.bmcgujarat.com ઉપરથી તથા ઓનલાઈન ટેન્ડર્સ https://bmc.nprocure.com વેબ સાઈટ ઉપર તા.૦૮/૦૯/૨૦૨૨ થી ઉપલબ્ધ થશે.

> કાર્યપાલક ઈજનેર રોડ વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા

માહિતી-ભાવ-૫૫૮/૨૨



Kiri Industries Limited Future Full of Colours

(CIN-L24231GJ1998PLC034094) રજીસ્ટર્ડ ઓફીસઃ ૭મો માળ, હસુભાઈ ચેમ્બર્સ, ટાઉનહોલ સામે, એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬ સંપર્ક નં. : (પી) +૯૧ ૭૯ - ૨૯૫૭૪૪૩૭૧/૭૨/૭૩, કેક્સ: +૯૧ ૭૯ - ૨૯૫૭૪૩૭૪ ઈમેઈલ આઈ $\mathfrak A$: info@kiriindustries.com; વેષસાઇટ: www.kiriindustries.com

૨૪મી વાર્ષિક સાધરણ સભાની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કીરી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સભ્યોની ૨૪મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) ગુરુવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૨ના રોજ બપોરે ૨.૩૦ વાગે, કંપનીધારા, ૨૦૧૩ની જોગવાઈના પાલન અર્થે અને ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય (એમસીએ)ના સામાન્ય પરિપત્ર ક્રમાંક ૧૪/૨૦૨૦, 19/2020, 20/2020, 02/2021, 21/2021 અને ૦૨/૨૦૨૨ તથા સેબી પરિપત્ર ક્રમાં ક SEBI/HO/CFD/CMD1/CIR/ P/2020/79, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 अने SEBI/ HO/CFD/CMD2/CIR/P/2022/62 (હવે પછી સંયુક્ત રીતે સરક્યુલર્સ તરીકે ઉલ્લેખ થશે) સાથે વંચાણે લેવામાં આવતા ધ સેબી (લિસ્ટિંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડીસ્ક્લોઝર રીકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન, ૨૦૧૫ (લિસ્ટિંગ રેગ્યુલેશન)નું અનુપાલન કરતાં વીડિયો કોન્ફરન્સ (V/C)ની સવિધા મારફત એજીએમની નોટીસમાં જણાવેલા કામકાજ કરવા માટે યોજવામાં આવશે.

વધુમાં, ઉપરોક્ત પરીપત્રો અને લીસ્ટીંગ રેગ્યુલેશન્સ મુજબ તાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેના વાર્ષિક અહેવાલની સાથે એજીએમની નોટીસ ફક્ત ઈલેક્ટ્રોનિક મોડ મારફત જે શેરધારકોના ઈમેઈલ એડ્રેસ ઓગસ્ટ ૨૬, ૨૦૨૨, શુક્રવારના રોજ કંપની/ ડીપોઝીટરી પાસે નોંધાયેલ હશે તેઓને જ સપ્ટેમ્બર ૦૩, ૨૦૨૨ના રોજ મોકલી આપવામાં આવેલ છે. ૨૪મી એજીએમની નોટીસ સાથે વર્ષ ૨૦૨૧-૨૨ માટેનો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.kiriindustries.com, સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com અને www.nseindia.com, તથા સેંટ્રલ ડીપોઝીટરી સર્વિસીસ ઈન્ડિયા લીમીટેડ (સીડીએસએલ)ની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે.

ધ કંપનીઝ (મેનેજમેંટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ સાથે વંચાશે લેવામાં આવતા કંપની ધારાની કલમ ૯૧ અને ધ લીસ્ટીંગ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન ૪૨ના અનુસંધાને , કંપનીના સભ્યોનું રજીસ્ટર અને શેર ટ્રાન્સફર બૂક એજીએમના હેતુસર શુક્રવાર, ૨૩મી સપ્ટેમ્બરથી ગુરુવાર, ૨૯મી સપ્ટેમ્બર (બંને દિવસો સમાવિષ્ટ)સુધી બંધ રહેશે અને રીમોટ ઇ-વોટિંગ અથવા સભા દરમિયાન ઇ-વોટિંગ મારફત મત આપવા માટેની પાત્રતા નક્કી કરવા માટે કટ-ઑફ તારીખ ગુરુવાર, સપ્ટેમ્બર ૨૨ , ૨૦૨૨ છે.

કંપની ધારાની કલમ ૧૦૮ અને તે હેઠળ બનાવવામાં આવેલા નિયમો બનુસાર, ફક્ત ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મતદાન મારફત જ સર્વ કામકાજ કરવામાં આવશે. કટ–ઑફ તારીખે શેર ધારણ કરનાર સભ્યો માટે રીમોટ ઇ-વોટિંગ નો પ્રારંભ સોમવાર, સપ્ટેમ્બર ૨૬, ૨૦૨૨ના રોજ સવારે ૯-૦૦ ક. (ભારતીય સમય)એ થશે અને બુધવાર, સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૨ના રોજ સાંજના ૫-૦૦ ક. (ભારતીય સમય)એ સમાપ્ત થશે. ઉપરોક્ત તારીખ અને સમય પછી રીમોટ ઇ-વોટિંગ કરવા દેવામાં આવશે નહીં. એજીએમ દરમિયાન ઇ-વોટિંગ માટેની સૂચનાઓ એજીએમની નોટીસમાં આપવામાં આવેલી છે. રીમોટ ઇ-વોટિંગ મારફત મતાધિકારનો ઉપયોગ કરનાર સભ્યો એજીએમમાં ઉપસ્થિત રહી શકશે તથા ભાગ લઈ શકશે પરંતુ એજીએમ દરમિયાન ફરી મત આપી શકશે નહીં. નોટીસ મોકલવામાં આવ્યા પછી જેમને શેર પ્રાપ્ત કરેલ છે અને કટ-ઑફ તારીખે શેર ધારણ કરેલ છે તેવી વ્યક્તિઓ helpdesk.evoting@cdslindia.com ને વિનંતી મોકલીને લોગ ઇન વિગતો પ્રાપ્ત કરીને તેઓનો મત આપી શકશે. ઇ-વોટિંગ માટે અને લોગ ઇનની પદ્ધતિ માટે તથા વર્ચ્યુયલ સભામાં જોડાવા માટેની સૂચનાઓ એજીએમની નોટીસમાં આપવામાં આવેલી છે.


ઇ-વોટિંગ પ્રક્રિયાનું ન્યાયી અને પારદર્શક રીતે નિરીક્ષણ કરવા માટે આર.સી.તારપરા એન્ડ એસોસીએટસ, કંપની સેક્રેટરી, (M. No. -FCS 6165, COP No. - 5785) ની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં

ઇ-વોટિંગ સંબંધિત કોઈપણ પૂછપરછ માટે, શેરધારકો www.evotingindia.com પર હેલ્પ વિભાગમાં પ્રાપ્ય એફએક્ચૂ અને ઈવોટીંગ મેન્યુયલ જોઇ શકે છે અથવા શ્રી રાકેશ દળવી, સીનિયર મેનેજર, સીડીએસએલ, એ વિંગ, ૨૫મો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મીલ કમ્પાઉન્ડ, એન એમ જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૧૩, ઇ-મેઈલ: <u>helpdesk.evoting@cdslindia.com</u> પર સંપર્ક કરી શકે છે અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ પર કોલ કરી શકે છે.

તારીખઃ સપ્ટેમ્બર ૦૩, ૨૦૨૨ સ્થળઃ અમદાવાદ

કીરી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ વતી સુરેશ ગોંડલીયા કંપની સેક્રેટરી

તારીખ: 03-09-2022



નિયમો અને સેબી (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર્સ આવશ્યકતાઓ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ [મ્લેબી (LODR) રેગ્યુલેશન્સ] નો સામાન્ય સકર્યુલર નં. ૧૪/૨૦૨૦, ૧૭/૨૦૨૦ અને ૨૦/૨૦૨૦ સાથે વાંચતા તારીખ એપ્રિલ ૦૮, ૨૦૨૦, એપ્રિલ ૧૩, ૨૦૨૦ અને મે ૧૨, ૨૦૨૦ અનુક્રમે કોર્પોરેટ બાબતોના મંત્રાલય ("MCA સકર્યુલરસ") દ્વારા જારી કરાયેલ અને સકર્યુલર નં. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 તારીખ મે ૧૨, ૨૦૨૦ ના રોજ સિક્યુરિટીઝ અને એકસર્ચન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરાયેલ (સેબી સકર્યુલર) દ્વારા બહાર પાડવામાં આવેલ અને વધુમાં સકર્યુલર નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 તારીખ મે ૧૩, ૨૦૨૦ ના સંબંધમાં સેબી (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર્સ આવશ્યકતાઓ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ની અમૂક જોગવાઈઓનું પાલન કરવામાં છૂટછાટ મુજબ આથી નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે કે કંપનીના શેરહોલ્ડરોની સત્તાવીસ મી વાર્ષિક સામાન્ય મીટિંગ ("AGM") ગુરૂવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ સવારે સામાન્ય મીટિંગ ("AGM") **ગુરૂવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨** ના રોજ સવારે ૧૦.૩૦ વાગે યોજાશે. AGM ની નોટિસમાં જણાવ્યા મુજબ બિઝનેશનો વ્યવહાર કરવા કોઇ પણ વ્યકિતની પ્રત્યક્ષ હાજરી વીના, વિડિયો કોન્ફરન્સિંગ "VC") / અન્ય ઓડિઓ વિઝયુઅલ મીન્સ ("OAVM") દ્વારા કરવામાં આવશે. વધુમાં જણાવવાનું કે ઉપર જણાવેલ સકર્યુલરમાં શેર હોલ્ડરોને વાર્ષિક અહૈવાલોની ફીઝીકલ છાપવાની તથા મોકલવા ના સંદર્ભે કંપનીઓને છુટછાટ આપવામાં આવેલી છે. તદ્દનુસાર, FY 2021-22 ના વાર્ષિક અહેવાલો અને રુગમી વાર્ષિક સામાન્ય મીટીંગ (AGM) ની નોટિસ ઈમેઈલ મારફતે મોકલેલ છે કે જે શેર હોલ્ડરો ના ઈમઈલ સરનામા કંપની / રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (RTA)/ ડિપોઝિટરી સહભાગીઓ સાથે નોંધોયેલા છે. કંપની એક્ટ ૨૦૧૩ની કલમ ૯૧ અને સેબી (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર્સ આવશ્યકતાઓ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના રેગ્યુલેશન્સ, ૪૨ના અનુસંધાનમાં, કંપનીના સભ્યોનું રજિસ્ટર અને શેર ટ્રાન્સફર યુકે રહ, સપ્ટેમ્બર,

૨૦૨૨ થી ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી બંધ રહેશે. (બંને દિવસો સહિત) કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૯૧ અને સેબીના નિયમ ૪૪ (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર્સ આવશ્યકતાઓ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના અનુસંધાનમાં અને તેમાં સુધારા કરવામાં આવ્યા છે. કંપની તેના શેરધારકોને ઈ-વોટિંગ સુવિધાઓ પ્રદ્રાન કરવા ઉત્સુક છે જેથી તેઓ તેમના વોટ્ને સ્ક્ષમ બનાવી શકે. ઉપરોક્ત નોટિસમાં જણાવેલ તમામ ઠરાવો ઉપર ઈલેક્ટ્રોનિક માધ્યમ થી વોટ આપી શકે. કંપુની એક્ટ, ૨૦૧૬ની જોગવાઈઓ અને તેના

નીચે જણાવ્યા મુજબના નિયમો અનુસાર વિગતો -૧) AGMની નોટિસમાં જણાવ્યા મુજબનો બિઝનેશ ઈલેક્ટ્રોનિક માધ્યમ થી થશે. ર) વોટિંગ સમય ૨૬, સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૯ વાગે ચાલુ થશે અને ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ના સાંજે ૫-૦૦ વાગે બંધ થશે.

3) ઈલેક્ટોનિક માધ્યમ થી AGMમાં વોટિંગ કરવાની યોગ્યતા નકકી કરવા માટેની કટ ઓફ ડેટ ૨૨, સપ્ટેમ્બર ૨૦૨૨ છે.

૪) કોઈ પણ વ્યકિતએ ૨૨ સપ્ટેમ્બર્ ૨૦૨૨ ના રોજ નોટિસ મોકલયા ની કટ ઓફ ડેટ પછી શેર ધારક બન્યા હોય તો તેઓ evoting@nsdl.co.in or mahendrazenith@hotmail.com ઉપર વિનંતી કરી લોગઈન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે.

પ) સભ્યો નોંધ લે કે (i) રીમાર્ટ ઈ-વોટિંગ મોડયુલ ૨૮, સપ્ટેમ્બર ૨૦૨૨ સાંજે ૫-૦૦ વાગે NSDL દ્વારા બંધ કરવામાં આવેશે અને એક વાર સભ્ય કોઈ ઠરાવ પર વોટ આપશે તે પછીથી સભ્યને તે બદલવા દેવામાં આવશે નહી.(ii) વિડિયો કો-ફરન્સીંગ (VC) દ્વારા ૨૭મી AGM બોલાવવામાં આવશે તેથી ફીઝીકલ બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાશે નહી જો કે સભ્યો ઈ-વોટીંગ દ્વારા પોતાનો વોટ આપી શકે છે જે AGM સમયે ઉપલબ્ધ કરાવામાં આવશે. (iii) જે સભ્યોએ AGM પહેલા રીમોટ ઈ-વોર્ટિંગ દ્રારા પોતાનો વોટ આપયો છે તે વિડિયો કોન્ફ રન્સીંગ (VC) દ્રારા AGMમાં પણ હાજરી આપી શકે છે પરંતુ ફરીથી પોતાનો વોટ આપી શકશે નહી. (iv) કોઈ વ્યક્તિ કે જેનું નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરી દ્રારા જાળવવામાં આવેલા લાભકારક માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલ છે તે ફક્ત રીમોટ ઈ-વોટિંગની

સુવિધા તેમજ ઈ-વોટિંગની હકદાર રહેશે અને દ) રીમોટ ઈ-વોટિંગની પ્રક્રિયા અને રીત માટે સભ્યો AGM બોલાવવાની નોટિસમાં આપેલી સૂચનાઓ જોઈ શકે છે અને કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં સભ્યો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) નો સંદર્ભ લઈ શકો છો અને https://www.evoting.nsdl.co ના ડાઉનલોડ વિભાગ માં ઉપલબ્ધ સભ્યો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકા અથવા ટોલ ફ્રી નંબર 1800-1020-990 & 1800 2244 30 ઉપર NSDL નો સંપર્ક કરવો. ફીઝીકલ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો કે જેમના ઈમેલ સરનામા કંપનીમાં નોંધાયેલ નથી તેઓ રીમોટ ઈ-વોટિંગ દ્રારા અથવા મીટીંગ સમયે ઈ-વોટિંગ દ્રારા અને નોંધમાં દર્શાવેલ સુચનાઓને અનુસરીને તેમનો વોટ્ આપી શકે છે અને ૨૭મી AGM બોલાવતી તારીખ ૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજની નોટિસ વિભાગમાં ઉલ્લેખિત સૂચનાઓને અનુસરીને. વધુમાં ઉપરોક્ત નોટિસ કંપનીની વેબસાઈટ www.achyuthealthcare.com ઉપર અને સ્ટોક એક્ષચેન્જ www.bseindia.com ઉપલબ્ધ છે.

કૃંપનીએ શ્રી કમલેશ એમ. શાહ, પ્રેક્ટીસીંગ કંપની સેક્રેટરી (C.P.No.2072) ની વાર્ષિક સામાન્ય સભામાં રીમોટ વોટ્રિંગ અને ઈ-વોટિંગ પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવા માટે સ્ક્રુટીનાઈઝર તરીકે નિયુકત કર્યા છે.

સભ્યોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં અને કંપની અને/ અથવા તેના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (RTA) ને શેર્સના કિસ્સામાં તેમના ડીપી સાથે તેમના ઈમેઈલ એડ્રેસની નોંધણી/ અપડેટ કરે. ભવિષ્યમાં કંપની તરફથી ઈમેઈલ દ્રારા વાર્ષિક અહેવાલો, નોટિસો, સકર્યુલર વિગેરેનું કોમ્યુનીકેશન તે મારફતે થશે.

અચ્યુત હેલ્થકેર લિમિટેડ વતી **સહી/- પરાગ દવે** કંપની સેક્રેટરી - ACS : A54961